

જુલાઈ 20, 2018

બ્રામ્પટનમાં ઈન્વેસ્ટર (રોકાણકાર) નેટવર્કની શરૂઆત

બ્રામ્પટન, ઓન્ટેરિયો – બ્રામ્પટનના 50 જેટલા રોકાણકારો, સલાહકારો અને આગેવાનો બુધવાર, જુલાઈ 18 નાં રોજ, શહેર માટે નવું રોકાણકાર સમૂહ શરૂ કરતા પ્રસંગ માટે ભેગા થયા.

CBA કેટાલિસ્ટ્સ ઓફ બ્રામ્પટનને આંતરરાષ્ટ્રીય રોકાણકાર નેટવર્ક, કોસ બોર્ડર એન્જલ્સ એન્ડ એક્વિટી (CBA) મારફતે સહાયતા કરવામાં આવશે. તેઓના વૈશ્વિક નેટવર્ક, ઓનલાઈન પોર્ટલ અને પ્રસંગો મારફતે, અને સ્થાનિક ધંધાકીય આગેવાનો અને શહેરની ઈકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર ઓફિસ સાથેની ભાગીદારીમાં, આ સંસ્થાનું લક્ષ્ય સમુદાય અને આર્થિક વિકાસને તાણખો ચાંપવાનું છે.

શરૂઆતના આયોજનમાં નેટવર્કિંગ, પેનલમાં ચર્ચા અને પડાવ ઘટકનો (પિચ કોમ્પોનન્ટ) સમાવેશ થયો જેણે છ ધંધાકીય સાહસિકોને સમૂહમાં રોકાણ કે માર્ગદર્શન સુરક્ષિત કરવાની આશામાં પોતાના ધંધાઓને પડાવમાં જોયા.

“મને ગૌરવ છે કે બ્રામ્પટનમાં આપણાં વિશાળ નવીન સાહસિક સમુદાયના ભાગ તરીકે જોશીલા અને કટિબદ્ધ ધંધાકીય આગેવાનો છે,” બ્રામ્પટનના મેયર લિન્ડા જેફરીએ (Linda Jeffrey) કહ્યું. “આ લોકોને નેટવર્કિંગ મારફતે સાથે લાવવાથી અને સહયોગ સાધવાથી આપણાં શહેરમાં નવી તકો અને વિકાસ માટે બીજા એક ઉદ્દીપકનો ઉમેરો થાય છે.”

આયોજનની પેનલ ચર્ચામાં ધંધાકીય સાહસિકોને કેનેડિયન [સ્ટાર્ટ-અપ વિઝા કાર્યક્રમ](#) મારફતે પૂરી પાડેલી તકો પર ધ્યાન કેન્દ્રિત થયું. આ કાર્યક્રમ સ્ટાર્ટ-અપ ધંધાકીય સાહસિકોને કાયમી રહેદાણું અને ભંડોળ પૂરું પાડે છે જેઓમાં કેનેડામાં એવી નવીન કંપનીઓ ઊભી કરવાની સંભાવના હોય છે જે નવી નોકરીઓ ઊભી કરી શકે, આર્થિક વિકાસ વધારી શકે, અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે છે. પેનલ સભ્ય અને JobAdX નાં ધંધાકીય સાહસિક અમિત ચૌહાણે (Amit Chauhan) આ કાર્યક્રમમાં પોતાનો અનુભવ વહેંચ્યો, અને તેમની સાથે ચર્ચામાં CBA પ્રમુખ કૌશલ ચોકસી, યુરી નાવારો, CEO - નેશનલ એન્જલ કેપિટલ સંસ્થા અને અન્ય સ્થાનિક આગેવાનો જોડાયા હતા.

બ્રામ્પટનના અશ્વિન સાંઝગીરી (Ashwin Sanzgiri), સ્કાલ ગ્રુપ અને કોસ બોર્ડર એન્જલ્સના ઉપ-પ્રમુખ પોતાના પ્રયત્નો થકી આ રોકાણકાર સમૂહ બનાવવામાં આગેવાન રહ્યા છે, અને તેઓ સ્થાનિક ચેપ્ટર માટે ચીફ કેટાલિસ્ટ રહેશે. “મને વૈશ્વિક નવીન શોધના નક્શા પર બ્રામ્પટનને જોવાનું ગમશે,” સાંઝગીરીએ કહ્યું. “આપણી પાસે કેટાલિસ્ટ્સનું ઈલેક્ટ્રિક મિશ્રણ અગાઉથી છે જે શરૂઆત દરમિયાન સમગ્ર GTA માંથી, બ્રામ્પટન સહિતના કેટલાક ઉચ્ચ ગુણવત્તાના સ્ટાર્ટ-અપ્સ અને સ્થાનિક ધંધાઓને પ્રતિભાવ આપવામાં સક્રિયપણે સહભાગી રહ્યું.”

શરૂઆતના આયોજનમાં સ્ટાર્ટ-અપ્સમાં સામેલ હતા:

- અમિત ચૌહાણ (Amit Chauhan), CEO, JobAdX (જોબ-એડએક્સ)
- મેલોરી મેકવેન (Mallory McKewen), CEO, BridesMade (બ્રાઈડ્સમેડ)
- કોનર ટિડ (Conner Tidd), કોન્ફાઉન્ડર (સહ-સંસ્થાપક), Just Vertical (જસ્ટ વર્ટિકલ)
- ટ્રેસી પેપી (Tracy Pepe), સંસ્થાપક અને એડ્રિયન પેપી (Adrian Pepe), ડિરેક્ટર, નોઝ નોઝ ડિઝાઈન (Nose Knows Design) (ધી સેન્ટેડ લાઈર (The Scented L'air))
- રિચાર્ડ બર્ટન-વિલિયમ્સ (Richard Burton-Williams), ટીમ સભ્ય, Justwealth (જસ્ટ વેલ્થ)
- અદનાન ઝુબેરી (Adnan Zuberi), સંસ્થાપક અને અઝમાટ ઝુબેરી (Azmat Zuberi), સંસ્થાપક, NoteTonic (નોટ-ટોનિક)

CBA કેટાલિસ્ટ્રસ ઓફ બ્રામ્પટનના ચાર્ટર્ડ સભ્યો સમૂહમાં ભૂમિકાઓ ફાળવવામાં, અને સ્થાનિક સ્ટાર્ટ-અપ ધંધાઓ અને બ્રામ્પટનના ધંધાકીય સમુદાયમાં અન્ય હિતધારકો સાથે જોડાવામાં આગળ વધશે. આગામી આયોજન ઓગસ્ટના અંતે કરવામાં આવ્યું છે.

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર અને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.